



# રાજકોટ મહાનગર સેવાસદન

બાસ્કેટબોલ કોર્ટ ઇન્સ્ટીટ્યુટ / સ્કુલ/કોલેજ/સંસ્થા/NGO/એકેડમીને કોચીંગના હેતુ માટે ભાડેથી  
મેળવવાની વિગતો આપવા બાબતનું ફોર્મ

૧	ભાવ ભરનારનું પુરુ નામ:-	
૨	ભાવ ભરનારનું પુરુ સરનામું:-	
૩	સંચાલકનું પુરુ નામ:-	
૪	સંચાલકનું પુરુ સરનામું:-	
૫	સંચાલકના કોન્ટેક્ટ નંબરની વિગત:-	મોબાઈલ નંબર: ઓફીસ નંબર: રેસીડેન્સ નંબર:
૬	પ્રતિ વર્ષ કોર્ટ ભાડે આપવાની અપસેટ પ્રાઈઝ રૂ. ૯૦,૦૦૦/- હોય, જે ધ્યાને લઈ કોર્ટ ભાડે મેળવવાનો ભાવ:-	પ્રતિ વર્ષ કોર્ટનો ભાવ: અંકે રૂ.

સ્થળ: .....

તારીખ: .....

ભાવ ભરનારની સહી:	
ભાવ ભરનારનું નામ:	
ભાવ ભરનારની સંસ્થાનું નામ:	

બાસ્કેટબોલ કોર્ટ ઇન્સ્ટીટ્યુટ/સ્કુલ/કોલેજ/સંસ્થા/NGO/એકેડમીને કોચીંગના હેતુ માટે ભાડેથી મેળવવા અંગેની શરતો તથા નિયમો

1. એકેડમી માટે ૦૨ કોર્ટ પૈકી ૦૧ કોર્ટ ભાડે આપવામાં આવશે. આ ૦૧ (એક) કોર્ટનું પ્રતિ વર્ષનું અપસેટ ભાડું રૂ. ૯૦,૦૦૦/- (અંકે રૂપિયા નેવું હજાર પુરા) રહેશે.
2. એકેડમી માટે સિક્યોરીટી ડીપોઝીટ મંજુર થયેલ ભાડાની રકમના ૦૫% મુજબ રહેશે.
3. એકેડમી માટે કોર્ટ ૦૨ (બે) વર્ષ માટે ભાડે આપવામાં આવશે. આ ૦૨ (બે) વર્ષની મુદત અલોટમેન્ટ લેટર આપ્યાની તારીખથી ગણવામાં આવશે.
4. કોર્ટ ભાડે રાખનાર ઇન્સ્ટીટ્યુટ/સ્કુલ/કોલેજ/સંસ્થા/NGO/એકેડમીએ બાસ્કેટબોલના કોચીંગ માટે મુખ્ય કોચ તરીકે નેશનલ પ્લેયર કક્ષાના વ્યક્તિ રાખવાના રહેશે. આ ટેન્ડર ફોર્મ સાથે મુખ્ય કોચના અનુભવના સર્ટિફિકેટ સામેલ રાખવાના રહેશે.
5. કોર્ટ ભાડે રાખનારે મંજુર થયેલ ભાડાના દર પર GST ભરવાનો રહેશે અને નિયત સ્ટેમ્પ પર રાજકોટ મહાનગરપાલિકા જોગ કરારનામું કરી આપવાનું રહેશે.
6. એકેડમી માટે કોર્ટ ભાડે રાખવા અંગે એક કરતા વધુ અરજીઓ આવ્યેથી મહત્તમ ભાવ (H1) ભરનારને કોર્ટ ભાડે આપવામાં આવશે. મહત્તમ ભાવ (H1) ભરનારને કોર્ટ ભાડે આપવાની મંજુરી કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકા કક્ષાએ આપવામાં આવશે.
7. એકેડમી માટે કોર્ટ ભાડે રાખનારે ભાવ મંજુર થયે કરારનામું સ્વખર્ચે કરી આપવાનું રહેશે. એકેડમી માટે કોર્ટ ભાડે રાખનાર પાસેથી ભાડું એડવાન્સ ચેકથી કુલ ભાડાની રકમના બે (૦૨) સરખા ભાગમાં વસુલવામાં આવશે. આ એડવાન્સ ચેક તથા સિક્યોરીટી ડીપોઝીટની રકમનો ચેક જમા કરાવ્યા બાદ જ વર્ક ઓર્ડર મળવાપાત્ર થશે.
8. વાર્ષિક ધોરણે તાલીમ માટે એકેડમી અથવા કોચીંગ માટે કોર્ટ ભાડે રાખનાર સંસ્થા, કોર્ટનો ઉપયોગ સવારે ૬ થી બપોરે ૧ અને સાંજે ૪ થી ૯ દરમિયાન જ કરી શકશે. આ સમય કોઈપણ સંજોગોમાં ફેરવી શકાશે નહિ.
9. એકેડમી માટે કોર્ટ ભાડે રાખવાથી, ભાડે રાખનાર તથા તેમાં તાલીમ આપનાર કોઈપણ વ્યક્તિ, સંસ્થા વિગેરેનો કોર્ટની માલિકી અંગેનો કે રાજકોટ મહાનગરપાલિકામાં કોઈપણ રીતે નોકરી કે અન્ય કોઈપણ બાબત અંગેનો હક્ક પ્રસ્થાપિત થઈ શકશે નહિ.
10. એકેડમી તથા મેચ /ટુર્નામેન્ટ/કેમ્પ વિગેરે માટે કોર્ટ ભાડે રાખનાર સંસ્થા/વ્યક્તિ માત્ર પોતે જ આ કોર્ટનો ઉપયોગ કરી શકશે. કોર્ટ પેટા ભાડેથી આપી શકશે નહીં. એટલેકે ભાડે રાખનાર સિવાય કોર્ટનો ઉપયોગ અન્ય કોઈપણ વ્યક્તિ/સંસ્થા કરી શકશે નહિ.
11. એકેડમી તથા મેચ/ટુર્નામેન્ટ/કેમ્પ વિગેરે માટે કોર્ટ ભાડે રાખનાર કોર્ટ પરિસર ખાતે જાહેરાત કરવા માંગતા હોય તો રૂ.૫૦૦/- પ્રતિ દિન/પ્રતિ બેનર (હોર્ડીંગ,ફ્લેક્સ વિગેરે) લેખે

- અલગથી, રાજકોટ મહાનગરપાલિકામાં ભરપાઈ કરવાના રહેશે. આ જાહેરાત કાનૂની રીતે નિષેધાત્મક અને સુરૂચિનો ભંગ ન થાય તેવી હોવી જોઈએ.
12. એકેડમી તથા મેચ/ટુર્નામેન્ટ/કેમ્પ વિગેરે માટે કોર્ટ ભાડે રાખનાર કોર્ટ પરિસર ખાતે જાહેરાત કરે તે કિસ્સામાં, જાહેરાતની કુલ આવક પૈકીની ૫૦% રકમ રાજકોટ મહાનગરપાલિકાને ચુકવવાની રહેશે.
  13. એકેડમી તથા મેચ /ટુર્નામેન્ટ/કેમ્પ વિગેરે માટે કોર્ટ ભાડે રાખનારે ભાડાની રકમ પર GST તથા સરકારશ્રી દ્વારા વખતો વખત નિયત થયેલ કર-વેરા ચુકવવાના રહેશે. જે ભાડાની નિયત થયેલ રકમ ઉપરાંતના રહેશે.
  14. કોર્ટનો ઉપયોગ કરતી વખતે કોઈપણ વ્યક્તિને કોઈપણ ઈજા,નુકસાન કે જાનહાનિ થયે રાજકોટ મહાનગરપાલિકાની કોઈ જવાબદારી રહેશે નહીં.
  15. કોર્ટ ભાડે રાખનારે તથા કોર્ટમાં સભ્યપદ મેળવનારે નિયત ક્વોલીટીના સ્પોર્ટ્સ શુઝ પહેરેલ હશે તો જ કોર્ટ ખાતે પ્રવેશ આપવાનો રહેશે.
  16. કોર્ટનો ઉપયોગ કરતી વખતે કોર્ટ પરિસરમાં આવેલ કોઈપણ વસ્તુને નુકશાન/અડચણ ન થાય તેની તકેદારી રાખવાની રહેશે. આવું થયે સીક્યુરીટી ડીપોઝીટ જપ્ત કરવામાં આવશે તથા તફાવતની રકમ નિયમાનુસાર વસુલ કરવામાં આવશે. જે કોર્ટનો ઉપયોગ કરનારને બાધ્ય રહેશે.
  17. એકેડમી માટે કોર્ટ ભાડે રાખનારે સફાઈ, વીજળી,સીક્યુરીટી સિવાયનો અન્ય આનુસંગિક તમામ ખર્ચ તથા અન્ય તમામ વ્યવસ્થાપક સ્ટાફ સ્વ ખર્ચે (પરભારે) રાખવાના રહેશે.
  18. કોર્ટ પરિસરમાં કોઈપણ ફૂડ પેકેટસ કે અન્ય ફૂડ આઈટમ સાથે લાવી શકાશે નહીં.ધુમ્રપાન,પાન,ફાકી,કેફી દ્રવ્યોનું સેવન નિષેધ રહેશે. આવું કરવાના કિસ્સામાં કોર્ટ કોઓર્ડિનેટરશ્રી રૂ. ૫૦૦/- દંડ વસુલ કરશે અને કોર્ટ ખાલી કરાવશે.
  19. રાજકોટ મહાનગરપાલિકાના વખતો વખતના ઠરાવો/હુકમો તથા પરિપત્રોથી નિયત કરાયેલ તથા નિયત કરવામાં આવનાર તમામ નિયમો, શરતો તથા જોગવાઈઓ કોર્ટ ભાડે રાખનારને બંધનકર્તા રહેશે. જેનો ભંગ થયે ધોરણસરની કાર્યવાહી કરવામાં આવશે.
  20. રાજકોટ મહાનગરપાલિકાને કોર્ટની જરૂર પડયે એકેડમી માટે કોર્ટ ભાડે રાખનારે કોર્ટ ફાળવવાનો રહેશે. જે માટે રાજકોટ મહાનગરપાલિકા કોઈ વળતર ચુકવશે નહીં અને અન્ય કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરી આપશે નહીં.
  21. એકેડમી માટે કોર્ટ ભાડે રાખનારે, કોર્ટ ખાતે કોઈપણ ટુર્નામેન્ટ યોજતા પુર્વે કમિશનરશ્રી કક્ષાએ મંજૂરી લેવાની રહેશે.
  22. મેચ/ટુર્નામેન્ટ વિગેરે દરમિયાન આયોજક દ્વારા, પ્રેક્ષકો માટે “પ્રવેશ ફી” રાખવામાં આવી હશે તો પ્રત્યેક દિવસની પ્રવેશ ફી ની કુલ આવકના ૧૫% રકમ ગેઈટમની તરીકે નિયત ભાડું તથા ડીપોઝીટની રકમ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાને અલગથી ચુકવવાની રહેશે.

23. કોર્ટ પરિસરમાં પરવાનગી વગર કાયમી કે હંગામી બાંધકામ કરી શકાશે નહીં કે મંડપ નાખી શકાશે નહિ. તેમજ કોર્ટ પરિસર ખાતે કોઈપણ ભોજન સંમારંભ યોજી શકાશે નહીં.
24. રાજકોટ મહાનગરપાલિકા સિવાયની અન્ય કોઈ સરકારી/અર્ધસરકારી કચેરીની આનુસંગિક મંજૂરી આયોજકે પરભારે અને સ્વખર્ચે અચુકપણે લેવાની રહેશે આ બાબતે રાજકોટ મહાનગરપાલિકાની કોઈપણ જવાબદારી રહેશે નહિ.
25. મેય/તાલીમ દરમિયાન ખેલાડી, કોચ અથવા આયોજક સિવાય અન્ય કોઈપણ વ્યક્તિ કોર્ટમાં પ્રવેશ કરી શકશે નહિ.
26. કોર્ટની ફાળવણી અથવા અન્ય કોઈપણ બાબતે વાદ-વિવાદ, તકરાર કે પ્રશ્ન ઉપસ્થિત થયે કમિશનરશ્રી, રાજકોટ મહાનગરપાલિકાનો નિર્ણય આખરી અને તમામને બંધનકર્તા રહેશે. આ અંગેનું ન્યાયક્ષેત્ર રાજકોટ રહેશે.
27. કોર્ટ ખાતે પ્રવેશ કરનાર તમામ તાલીમાર્થી તથા કોચે ફરજિયાત આઇ કાર્ડ સાથે રાખવાનું રહેશે.
28. આ માટે પ્રી-બીડ મીટીંગ તા.૧૮/૦૩/૨૦૧૯ ના રોજ સહાયક કમિશનરશ્રીની કચેરી, સેન્ટ્રલ ઝોન, પહેલો માળ, રૂમ નં ૦૫, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઇ રોડ, રાજકોટ ખાતે સવારે ૧૧:૦૦ કલાકે યોજાશે. તેમજ પાર્ટીઓએ સંપૂર્ણ ભરેલ ફોર્મ સીલબંધ કવરમાં તા.૨૫/૦૩/૨૦૧૯ સુધીમાં ઓફીસ સમય દરમિયાન ઓ.એસ.ડી ની કચેરી, શ્રી વીર સાવરકર ઇન્ડોર સ્ટેડિયમ, રેસકોર્ષ, રાજકોટ ખાતે આવેલ રાજકોટ મહાનગરપાલિકાની ઓફીસ ખાતે માત્ર રજીસ્ટર એ.ડી./ સ્પીડ પોસ્ટ મારફત રજૂ કરવાના રહેશે. સીલબંધ કવરમાં આવેલ ભાવો તા.૨૮/૦૩/૨૦૧૯ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે સહાયક કમિશનરશ્રીની કચેરી, સેન્ટ્રલ ઝોન, પહેલો માળ, રૂમ નં ૦૫, ડો. આંબેડકર ભવન, ઢેબરભાઇ રોડ, રાજકોટ ખાતે ખોલવામાં આવશે.
29. આ કામનું ટેન્ડર રાજકોટ મહાનગરપાલિકા અકાઉન્ટ શાખા ખાતેથી રૂ.૩૭૫/- (અંકે રૂપિયા ત્રણસો પંચોતેર પુરા) ટેન્ડર ફી ભરીને તા.૧૧/૦૩/૨૦૧૯ થી તા.૨૩/૦૩/૨૦૧૯ સુધી મેળવી શકાશે અથવા આ તારીખો દરમિયાન રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે. રાજકોટ મહાનગરપાલિકા અકાઉન્ટ શાખા ખાતેથી ફોર્મ મેળવ્યાના કિસ્સામાં ફી ભર્યાની રસીદની નકલ ટેન્ડર ફોર્મ સાથે સામેલ રાખવાની રહેશે અને રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઇટ પરથી ફોર્મ ડાઉનલોડ કર્યાના કિસ્સામાં રૂ.૩૭૫/- (અંકે રૂપિયા ત્રણસો પંચોતેર પુરા) નો “ રાજકોટ મહાનગરપાલિકા” જોગ કઢાવેલ ટેન્ડર ફી પેટેનો ડી.ડી ટેન્ડર ફોર્મ સાથે સામેલ રાખવાનો રહેશે. અન્યથા ટેન્ડર ફોર્મ રદબાતલ ગણાશે.
30. ટેન્ડર ફોર્મ સાથે રૂ.૩૦૦૦/- ની રકમનો “ રાજકોટ મહાનગરપાલિકા” જોગ કઢાવેલ અર્નેસ્ટ મની ડીપોઝીટ (EMD) પેટેનો ડી.ડી સામેલ રાખવાનો રહેશે. અન્યથા ટેન્ડર ફોર્મ રદબાતલ ગણાશે.

31. ટેન્ડર ફોર્મ સાથે સામેલ રાખવાના ડોક્યુમેન્ટની વિગત :

- ટેન્ડર ફી ભર્યાની રસીદ અથવા રૂ.૩૭૫/- ની રકમનો ડી.ડી
- રૂ.૩૦૦૦/- ની રકમનો EMD ડી.ડી.
- PAN કાર્ડની નકલ
- આધાર કાર્ડની નકલ
- બેંક પાસબુકની ઝેરોક્ષ
- મુખ્ય કોચના અનુભવના પુરાવા
- ઓફીસ એડ્રેસનો પુરાવો(હોય તો)
- GST રજીસ્ટ્રેશનનો પુરાવો (હોય તો)

**\*\* ઉપરોક્ત તમામ ડોક્યુમેન્ટ સ્વપ્રમાણિત (SELF ATTESTED) કરીને રાખવાના રહેશે.**

હું નીચે સહી કરનાર શ્રી ..... આ સાથે સામેલ ઉપરોક્ત તમામ શરતો અને નિયમો ( ૦૧ થી ૩૧ ) વાંચી, તમામ બાબતો જોઈ, વિચારી તથા સમજી બાસ્કેટબોલ કોર્ટ ભાડે લેવા બંધાઉ છું. જે બદલ નીચે સહી કરી આપુ છું.

સ્થળ: .....

તારીખ: .....

ભાવ ભરનારની સહી:	
ભાવ ભરનારનું નામ:	
ભાવ ભરનારની સંસ્થાનું નામ:	